



**MEHTA
SECURITIES
LTD.**

Regd. Office: 2, Law Garden Apt., Scheme 1, Opp. Law Garden, Ellisbridge, Ahmedabad-380006 Ph.: (079)26561000
CIN NO: L67120GJ1994PLC022740

Date : 15.11.2025

To,
BSE Limited,
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street Fort,
Mumbai - 400 001

Scrip Code: 511738

Sub: Intimation for publication of Standalone Unaudited Financial Results for the quarter and half year ended 30th September, 2025 in Newspapers

Dear Sir / Madam,

Please find enclosed herewith copy of newspaper publications dated 14th November, 2025, for the Standalone Unaudited Financial Results of the Company for the quarter and half year ended 30th September, 2025 taken by the board on 13.11.2025.

Kindly take the aforementioned on your record.

Thanking you,

Yours faithfully,

For Mehta Securities Limited



**Mahesh Moteevaras
Company Secretary and Compliance Officer**

Encl: As above

IFFCO Chairman Dileep Sanghani meets Prime Minister of Jordan Shri Jaafar Hassan



As part of a major initiative to strengthen India-Jordan collaboration in the fertilizer sector, IFFCO (Indian Farmers Fertiliser Cooperative Limited) Chairman Shri Dileep Sanghani met with Prime Minister of Jordan Shri Jaafar Hassan at the Prime Minister's residence in Amman. During this cordial meeting, both sides held detailed discussions on key issues such as the development of the fertilizer industry, adoption of modern technologies, enhancement of agricultural productivity and promotion of sustainable agriculture. Prime Minister Shri Jaafar Hassan appreciated the strong bilateral relations between India and Jordan, noting that cooperation in the agriculture sector would give a new direction to the economies of both countries. Shri Dileep Sanghani expressed his gratitude to the Government of Jordan for its continued support and cooperation, adding that joint efforts between IFFCO and JIFCO will lead to significant growth in fertilizer production in the coming years, directly benefiting farmers in both nations. On this occasion, JIFCO Chairman Prof. Mohammad K. Thneibat, IFFCO Managing Director Shri K. J. Patel, Deputy Managing Director Shri Rakesh Kapoor, and other distinguished dignitaries were also present.

CRESTCHEM LIMITED						
CIN: L24100GJ1991PLC015530						
Regd Office Address: Sr. No.550/1, Sub Plot No. 12,						
Village- Indrad, Taluka- Kadi, Mahesana- 382715						
Corporate Office:303B, Central Business Space, Opp: Fortune Land Mark Hotel, Opp: HDFC Bank, Near Usamanpura Cross Road, Ashram Road, Ahmedabad-38001						
UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30TH SEPT, 2025						
(Rs in Lacs)						
Sr. No.	Particulars	STANDALONE FINANCIALS		Half Year Ended	Year ended	Year ended
		Quarter ended				
		30.09.2025 Un-audited	30.06.2025 Un-audited	30.09.2024 Un-audited	30.09.2025 Un-audited	31.03.2025 Audited
1	Income					
	Revenue from operations	719.31	503.09	780.31	1,222.39	2,507.72
	Other Operating income	-	-	-	-	-
	a) Total Income from Operations (net)	719.31	503.09	780.31	1,222.39	2,507.72
	b) Other Income	14.52	12.81	12.03	27.32	43.87
	Total Income (a+b)	733.83	515.89	792.34	1,249.72	2,551.59
2	Expenses					
	a) Cost of Material Consumed	571.60	395.61	558.68	967.21	1,876.31
	b) Purchase of Stock-in-Trade	-	-	-	-	-
	c) Changes in Inventories of Finished Goods, Work-in-progress and stock-in-trade	-0.05	0.03	-0.23	-0.02	-0.03
	d) Excise duty on Sales	-	-	-	-	-
	e) Employee benefits expense	30.50	23.80	26.51	54.30	116.28
	f) Finance Costs	0.10	0.07	0.47	0.17	1.30
	f) Depreciation & amortization expenses	1.72	1.72	1.16	3.44	5.23
	g) Other Expenses	55.79	47.64	67.61	103.42	186.82
	Total Expenses (a+b+c+d+e+f+g)	659.67	468.87	654.20	1,128.53	2,185.91
3	Profit before Tax (1-2)	74.16	47.03	138.14	121.18	365.68
4	Tax Expenses					
	(i) Current Tax	19.31	12.26	38.55	31.57	93.86
	(ii) Deferred Tax	0.39	-0.03	-0.11	0.36	-0.96
	(iii) Short / Excess Provision of Income Tax	-	-	-	0.13	0.41
	Total Tax (i+ii)	19.70	12.23	38.44	31.93	93.38
5	Profit for the period (3-4)	54.46	34.80	99.70	89.26	272.65
6	Less: Non Controlling Interest	-	-	-	-	-
6	Net Profit after Non Controlling Interest (5-6)	-2.86	-2.86	-2.86	-2.86	-2.86
6	Other Comprehensive Income	-	-	-	-	-
7	Total comprehensive income for the period (5+6) (Comprising Profit/(Loss) and other Comprehensive income for the period)	54.46	34.80	99.70	89.26	272.65
8	Paid-up Equity share Capital -Face Value of ` 10 each.	300.00	300.00	300.00	300.00	300.00
9	Earning per equity share (EPS) in ` (not Annualised)					
	BASIC	1.82	1.16	1.13	2.98	9.09
	DILUTED	1.82	1.16	1.13	2.98	9.09
Notes :						
(i)	The Financial Results have been prepared in accordance with Indian Accounting Standards (Ind AS) as prescribed under section 133 of Companies Act,2013 read with Rule 3, of the Company's (Indian Accountg Standards) Rule 2015 and Relavent Amendments thereunder.					
(ii)	The above Unaudited Financial Results for the Quarter ended and half year ended on September 30, 2025 have been reviewed by the Audit Committee and were taken on record by the Board of Directors in their respective meetings held on 12th November, 2025 and a Limited Review of the same has been carried out by the Statutory Auditors of the Company.					
(iii)	The Statutory Auditors of the Company have carried out a "Limited Review" of the above results as per Regulations 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.					
(iv)	The Company operates only in one segment viz. Nutrition- Chemical Industries.					
(v)	Figures for the previous period have been regrouped, reclassified and restated wherever necessary to make them comparable with the current period's figures.					
				By order of Board of Directors For Crestchem Limited		
				Sd/- Dipak Patel Managing Director (DIN - 02052080)		
Place : Ahmedabad Date: 12th November, 2025						

MAS RURAL HOUSING & MORTGAGE FINANCE LIMITED

Registered Office: 4th Floor, Narayan Chambers, Behind Patang Hotel, Ashram Road, Ahmedabad - 380 009

BRANCH CLOSURE NOTICE

The borrowers in specific and the public in general are hereby notified that the branch office of the Company at T-8, Radha Arcade, Near Indira Statue, Taluka - Anand, District - Anand is going to be closed after 3 months and the new branch address shall be 107, First Floor, Narayan Empire, Near Panchal Hall, Anand - 388001.

If the same are not closed after 3 months, a separate intimation shall be made. For more details kindly connect at 079 69274100 / manish_dave@mas.co.in

For, MAS RURAL HOUSING & MORTGAGE FINANCE LIMITED

SD/-

AUTHORISED OFFICER

Date : 14-11-2025

PARKER AGRO-CHEM EXPORTS LIMITED

(CIN: L24110GJ1993PLC020102)

Registered Office: Block H, Plot 3 & 4, New Kandla - 370 2710 (Kutch)

Corporate office: 401, 4th Floor, Turquoise Building, Panchwati Five Roads, Ahmedabad-380006 (Gujarat) Website: www.parkeragrochem.in

UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30TH SEPTEMBER, 2025

The Board of Directors of the Company at the meeting held on 13th November, 2025 approved the Unaudited Financial Results for the quarter ended on 30th September, 2025 ("Results"). The same has been submitted to BSE in due compliance with the listing requirements.

The Results along with Auditors Report have been posted on the website of the Company at https://www.parkeragrochem.in/investor-relation.html and can be accessed by scanning the QR Code given in this Advertisement.

By Order of the Board,
For PARKER AGRO-CHEM EXPORTS LIMITED

SD/-

JAGDISH R. ACHARYA (DIN NO. 01251240)

CHAIRPERSON & MANAGING DIRECTOR

PLACE: AHMEDABAD

DATE: 13th November, 2025

NOTE: The above intimation is in accordance with Regulation 33 read with Regulation 47(1) of the SEBI (LODR) Regulations, 2015.

Hester Biosciences Ltd consolidated Net Profit in Q2FY26 rise 71% to Rs. 14.33 crore

Ahmedabad, Hester Biosciences Limited, one of India's leading animal health company, manufacturing vaccines and health products has reported consolidated net profit of Rs. 14.33 crore for the Q2 FY25-26, rise of 71% as compared to the net profit of Rs. 8.39 crore reported in the second quarter of FY 2024-25. Revenue from operations of the company for the Q2FY26 was reported at Rs.70.97 crore. EBITDA for Q2FY26 was reported at Rs. 23.60 crore (EBITDA margin 33%) as against EBITDA of Rs. 21.96 crore (EBITDA margin 26%) in Q2FY25. EPS for Q2 FY26 was Rs. 16.85 per share. Consolidated results include operations of subsidiaries from Nepal and Tanzania. Net Profit for H1 FY26 was reported at Rs. 31.63 crore, up 99% Y-o-Y from Rs. 15.88 crore in the corresponding period last year. EBITDA for H1FY26 was reported at Rs. 49.78 crore (EBITDA margin 32%) as against EBITDA of Rs. 41.69 crore (EBITDA margin 25%) in Q2FY25. For H1 FY26, company reported revenue of Rs. 155.07 crore. The company maintained strong operational discipline, through controlled overheads, process standardisation, and efficient manpower deployment. The focus remains on margin protection and cost optimisation, while positioning for an expected recovery in volumes during the second half of the year: (18-2)

Gujarat's Truckers Gear Up for an Electric Future

Ahmedabad, "Electric vehicles can help reduce pollution. Electric trucks are efficient and have higher horsepower. With the right knowledge, my business can adapt and grow. Learning about green mobility eased my fears that my business could be affected," observed Parth Rawal, an automobile parts dealer from Ahmedabad. He was among 59% of the total participants who heard about eTrucks for the first time during awareness events organised in Gujarat. Many attendees had seen e-bikes and e-three-wheelers, but had never heard of an eTruck, let alone explore the prospect of seeing one on Indian roads. Through Nayi Soch ki Sawaari, an awareness initiative by Centre of Excellence for zero emission trucking at IIT Madras, their questions, concerns and feedback are now shaping the discourse around clean freight. Another participant, Harpal Singh, a truck driver

Petrol pump operators are now fed up with ethanol-blended petrol

Surat, Till now, the common people were opposing the sale of petrol mixed with ethanol, now the petrol pump operators and the petrol pump association have come out against the government. The reason behind this is also very good! The South Gujarat Petrol Pump Dealers Association has written a letter to the government and claimed that we are losing lakhs of rupees due to petrol mixed with ethanol, because in coastal areas, petrol and ethanol are separated by chemical processing in petrol tanks. The government has made a rule to blend 20 percent ethanol in petrol sold across the country under the E20 policy, meaning that one-fifth of ethanol should be mixed in one liter of petrol. This rule has been implemented since last April. Two major controversies have arisen regarding it. The price of ethanol is much lower than petrol. Ethanol alone is sold at around Rs 65 per litre. If 20

percent ethanol is mixed in petrol, the price of petrol should come down, but there was discontent among the people when such a reduction was not made. Not only this, there were also many claims that ethanol-blended petrol damages old vehicles. Petrol in which ethanol is mixed has been considered.

TRUHOME FINANCE LIMITED

(Formerly Shriram Housing Finance Ltd.)

Head Office: Level -3, Wockhardt Towers, East Wing C-2, G Block, Bandra Kurla Complex, Bandra (East), Mumbai 400 051; Tel: 1800 102 4345 | Website: http://www.truhomefinance.in

Reg.Off.: Srinivasa Tower, 1st Floor, Door No.5, Old No.11, 2nd Lane, Cenatoph Road, Alwarpet, Teynampet, Chennai-600018

APPENDIX-IV-A [SEE PROVISION TO RULE 8(6)] SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with provision to Rule 8(6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower/s and Guarantor/s that the below described immovable properties mortgaged/ charged to Truhome Finance Limited (formerly Shriram Housing Finance Limited), the Physical Possession of which have been taken by the Authorized Officer of Truhome Finance Limited, will be sold on "As is where is", "As is what is" and "Whatever there is" basis for recovery of the balance due to Truhome Finance Limited from the Borrowers And Guarantors, as mentioned in the table.

Details of Borrowers and Guarantors, amount due, Short Description of the immovable property, reserve price and earnest money deposit and date of inspection are also given as:

Name of Borrowers/ Co-Borrowers/ Guarantors/Mortgagers	Amount of Recovery and date of Demand Notice	Reserve Price (Rs.) & Bid Increment	Date & Time of Auction	Contact Person Details – (AO and Disposal team)
Sorathiya Rohitbhai Jayantibhai, Sorathiya Kantaben Jayantibhai, Sorathiya Ketanbhai Jayantibhai, Makwana Chandrikaben Prahladbhai , Present Address :-Street no.1, Setelight chowk,Near Nagbai Mandir,Opp.Shakti Park,Anand Park,Rajkot-360003 Permanent Address :-Ashpuranagar-2,Kothariya Main Road, Rajkot-360002 Property Address :-Silver Park-A, Street No.2, Plot No.4 Near Bedi Chowkd,Near Lalpari River, Off.Morbi Road,Rajkot-360003	Rs.31,76,029/- (Rupees Thirty One Lakh Seventy Six Thousand Twenty Nine Only) as on dated. 09/06/2025 under reference of Loan Account No. SHLHRAJT0000030 Demand notice Date 12/06/2025	Rs.38,28,200/-(Rupees Thirty Eight lakh twenty eight thousand two hundred only) Bid Increment: Rs.10,000/- and in such multiples. Earnest Money Deposit (EMD) (Rs.) Rs.3,82,820/-(Rupees Three lakh eighty two thousand eight hundred twenty only) Last date for submission of EMD : 18-12-2025 Time 10.00 a.m. to 05.00 p.m.	19th - Dec - 2025 Auction Time: 11.00 A.M. to 01.00 p.m.	Ashfaq Patka 9819415477 Dharmendrasinh Chauhan-76007 62777 Property inspection Date. 18-12-2025, Time.11 AM to 1 PM

All that right, title, and interest of the property bearing Municipal Census No. 32, Municipal Tenement No. 0140-03-0201-0001-R admeasuring 40 Sq. Meters and Milkat No. 32/11, Municipal Tenement No. 0140-03-0096-0001-J admeasuring 139.39 Sq. Meters, with a plot area of 1001 Sq. Meters i.e. 111.22 Sq. Meters and construction area admeasuring 1549 Sq. Feet i.e. 143.957 Sq. Meters i.e. 172.11 Sq. Yards, situated in the scheme "Baliya Ni Chali", constructed on non-agricultural land bearing Survey No. (Oid) 96/1/2/B, T.P.No. 8, F.P. No. 69 Paiki, Jahangirpura-2 Ward, located at Mouje Dariyapur-Kazipur in the Registration District Ahmedabad and Sub-District Ahmedabad-6 (Naroda)...

Boundaries: East: Road, West: Road, North: Road, South: House No. 32/1

1) For detailed terms and conditions of the sale, please refer the website of Truhome Finance Limited (Formerly Shriram Housing Finance Limited) website.

2) The intending bidders have to submit their EMD amount to be deposited by way of RTGS/NEFT to the account details mentioned herein below: BANK NAME: AXIS BANK LIMITED BRANCH: BANDRA KURLA COMPLEX, MUMBAI BANK ACCOUNT NO. Current Account No. 911020045677633 IFSC CODE: UTIB0000230.

3) The mortgagors/borrowers are given a last chance to pay the total dues with further interest before auction, failing which secured assets will be sold as per above schedule.

4) The mortgagors/borrowers are requested to collect your all remaining movable items within period of 7 days without damages of the property. If you fail to take movable assets, then it would be deemed that you have no claim and no interest in taking back such items. In case you still prefer to ignore this notice, we shall be constrained to treat them as unclaimed and waste materials and shall not be liable for any loss or damage whatsoever to such articles and also may sell all movable items and adjust the amount against outstanding dues of your loan account. It will be also deemed that you have no claim and interest in taking back such items and also have no objection, if such items are disposed-off or sold by us as items are having negligible substantial value. Also note that by not taking the items within specified time, you will also relinquish any right or claim over such items in future.

5) NB: Please note that the secured creditor is going to issue the sale notice to all the Borrowers/ Guarantors/ Mortgagors by speed/ registered post. In case the same is not received by any of the parties, then this publication of sale notice may be treated as a substituted mode of service.

Place : Rajkot

Date : 14-11-2025

Sd/- Authorised Officer- Truhome Finance Limited (Formerly Shriram Housing Finance Limited)

MEHTA SECURITIES LIMITED

CIN: L67120GJ1994PLC022740

Reg. Off: 2, Law Garden Apartment, Scheme-1 , Opp. Law Garden, Ellisbridge, Ahmedabad – 380006 | E-mail : mehtasec@gmail.com | Website: www.mehtasecurities.com Ph: +91 9377578519

Extract of Statement of Standalone Unaudited Financial Results for the Quarter and Half year ended 30/09/ 2025 (Rs. In Lakhs except EPS)

Sr. No.	Particulars	Quarter ended 30/09/ 2025 (Unaudited)	Quarter ended 30/09/2024 (Unaudited)	Half Year ended 30/09/2025 (Unaudited)	Year ended 31 /03/2025 (Audited)
1	Total income from operation(Net)	13.20	14.04	18.64	45.41
2	Net profit / (loss) for the period (before tax, exceptional and /or extraordinary items)	5.82	7.81	-0.74	15.84
3	Net profit / (loss) for the period before tax (after exceptional and /or extraordinary items)	5.82	7.81	-0.74	15.84
4	Net profit / (loss) for the period after tax(after exceptional and /or extraordinary items)	5.82	7.81	-0.74	15.84
5	Total Comprehensive Income for the period comprising Profit(Loss) and Other Comprehensive Income for the period (after tax)	5.82	7.81	-0.74	15.84
6	Paid up Equity Share Capital(Rs.10/- each)	308.94	308.94	308.94	308.94
7	Other Equity				245.18
8	Earning per share (Rs. 10/-each)	0.19	0.25	-0.024	0.51
Basic and Diluted					

Note:

(1)The above is an extract of the detailed format of Unaudited Financial Results for the Quarter and Half Year ended 30/09/2025 filed with Stock Exchange under Regulation 33 of the SEBI(Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015.

(2)The full format of the same alongwith the notes is available on the website of Stock Exchange at www.bseindia.com and at the website of the Company at www.mehtasecurities.com

For, Mehta Securities Limited

SD/-

Bhavna D. Mehta

Chairperson & Managing Director (DIN: 01590958)

Place: Ahmedabad

Date : 13-11-2025

NOTICE

LARSEN & TOUBRO LIMITED

Regd.Office of the Company: L & T House, Ballard Estate, Narottam Morarjee Marg, Mumbai, Maharashtra, 400001

Notice is hereby given that the certificate(s) for the mentioned securities of the Company have been lost/misplaced and the holder(s) of the said securities have applied to the Company.

Any person who has claim in respect of the said securities should lodge such claim with the company at its Registered Office with in 15 days from this date, else the company will proceed to issue duplicate share certificate(s) without further intimation.

Name of the Holder	Folio No.	Kind of securities & Face value	No. Of Securities	Distinctive Nos.	Certificate Nos.
SHETH SHANTILAL KESHAVALAL	70395134	Equity Shares Face Value of Rs.2/- each	145	5778262 -5778406	111153
SHETH SHANTILAL KESHAVALAL	70395134	Equity Shares Face Value of Rs.2/- each	145	143764082 - 143764226	259187
SHETH SHANTILAL KESHAVALAL	70395134	Equity Shares Face Value of Rs.2/- each	290	579754034 - 579754323	374875
SHETH SHANTILAL KESHAVALAL	70395134	Equity Shares Face Value of Rs.2/- each	290	620786676 - 620786965	466373

Place: Halol

Date: 13-11-2025

PHYSICAL POSSESSION NOTICE

Branch Office : ICICI Bank Ltd. Office Number 201-B, 2nd Floor, Road No. 1 Plot No. B3, W/IT IT PARK, Wagale Industrial Estate, Thane (West)- 400604.

The Authorised ICICI Bank Officer under the Securitisation, Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued Demand Notices to the borrower(s) mentioned below, to repay the amount mentioned in the Notice within 60 days from the date of receipt of the said Notice.

Having failed to repay the amount, the Notice is issued to the borrower and the public in general that the undersigned has taken possession of the property described below, by exercising powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on the below-mentioned dates. The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property. Any dealings with the property will be subject to charges of ICICI Bank Limited.

Sr. No.	Name of the Borrower(s)/ Loan Account Number	Description of Property/ Date of Physical Possession	Date of Demand Notice/ Amount in Demand Notice (Rs)	Name of Branch
1.	Prahalad Prakash More/ Pooja Dubey- TBVP/00006944361	Flat No. 113, 1st Floor, Sai Tulsi Apartment, New Survey No. 446, Old Survey No. 330, Balitha, Valsad, Vapi- 396191/ November 08, 2025	November 05, 2024 Rs. 13,26,669.00/-	Vapi
2.	Santosh Kumar/ Poonam Devi - LBABD00006851767/ TBABD00006845491	Flat No. 203, 2nd Floor, Building-B, Srushti Residency, Desaiwad, Near Chhiri Police Chowki, Survey No. 163/1, New Survey No. 102, Chhiri, Valsad, Vapi- 396191/ November 08, 2025	March 28, 2025 Rs. 12,63,148.00/-	Ahmedabad

The above-mentioned borrowers(s)/guarantors(s) is/are hereby issued a 30 day Notice to repay the amount, else the mortgaged properties will be sold after 30 days from the date of publishing this Notice, as per the provisions under Rules 8 and 9 of Security Interest (Enforcement) Rules 2002.

Date: November 14, 2025

Sincerely Authorised Officer, For ICICI Bank Ltd.

TRUHOME FINANCE LIMITED

(Formerly Shriram Housing Finance Ltd.)

Head Office: Level -3, Wockhardt Towers, East Wing C-2, G Block, Bandra Kurla Complex, Bandra (East), Mumbai 400 051; Tel: 1800 102 4345 | Website: http://www.truhomefinance.in

Reg.Off.: Srinivasa Tower, 1st Floor, Door No.5, Old No.11, 2nd Lane, Cenatoph Road, Alwarpet, Teynampet, Chennai-600018

APPENDIX-IV-A [SEE PROVISION TO RULE 8(6)] SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with provision to Rule 8(6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower/s and Guarantor/s that the below described immovable properties mortgaged/ charged to Truhome Finance Limited (formerly Shriram Housing Finance Limited), the Physical Possession of which have been taken by the Authorized Officer of Truhome Finance Limited, will be sold on "As is where is", "As is what is" and "Whatever there is" basis for recovery of the balance due to Truhome Finance Limited from the Borrowers And Guarantors, as mentioned in the table.

Details of Borrowers and Guarantors, amount due, Short Description of the immovable property, reserve price and earnest money deposit and date of inspection are also given as:

Name of Borrowers/ Co-Borrowers/ Guarantors/Mortgagers	Amount of Recovery and date of Demand Notice	Reserve Price (Rs.) & Bid Increment	Date & Time of Auction	Contact Person Details – (AO and Disposal team)
Sorathiya Rohitbhai Jayantibhai, Sorathiya Kantaben Jayantibhai, Sorathiya Ketanbhai Jayantibhai, Makwana Chandrikaben Prahladbhai , Present Address :-Street no.1, Setelight chowk,Near Nagbai Mandir,Opp.Shakti Park,Anand Park,Rajkot-360003 Permanent Address :-Ashpuranagar-2,Kothariya Main Road, Rajkot-360002 Property Address :-Silver Park-A, Street No.2, Plot No.4 Near Bedi Chowkd,Near Lalpari River, Off.Morbi Road,Rajkot-360003	Rs.31,76,029/- (Rupees Thirty One Lakh Seventy Six Thousand Twenty Nine Only) as on dated. 09/06/2025 under reference of Loan Account No. SHLHRAJT0000030 Demand notice Date 12/06/2025	Rs.38,28,200/-(Rupees Thirty Eight lakh twenty eight thousand two hundred only) Bid Increment: Rs.10,000/- and in such multiples. Earnest Money Deposit (EMD) (Rs.) Rs.3,82,820/-(Rupees Three lakh eighty two thousand eight hundred twenty only) Last date for submission of EMD : 18-12-2025 Time 10.00 a.m. to 05.00 p.m.	19th - Dec - 2025 Auction Time: 11.00 A.M. to 01.00 p.m.	Ashfaq Patka 9819415477 Dharmendrasinh Chauhan-76007 62777 Property inspection Date. 18-12-2025, Time.11 AM to 1 PM

All that right, title, and interest of the property bearing Municipal Census No. 32, Municipal Tenement No. 0140-03-0201-0001-R admeasuring 40 Sq. Meters and Milkat No. 32/11, Municipal Tenement No. 0140-03-0096-0001-J admeasuring 139.39 Sq. Meters, with a plot area of 1001 Sq. Meters i.e. 111.22 Sq. Meters and construction area admeasuring 1549 Sq. Feet i.e. 143.957 Sq. Meters i.e. 172.11 Sq. Yards, situated in the scheme "Baliya Ni Chali", constructed on non-agricultural land bearing Survey No. (Oid) 96/1/2/B, T.P.No. 8, F.P. No. 69 Paiki, Jahangirpura-2 Ward, located at Mouje Dariyapur-Kazipur in the Registration District Ahmedabad and Sub-District Ahmedabad-6 (Naroda)...

Boundaries: East: Road, West: Road, North: Road, South: House No. 32/1

1) For detailed terms and conditions of the sale, please refer the website of Truhome Finance Limited (Formerly Shriram Housing Finance Limited) website.

2) The intending bidders have to submit their EMD amount to be deposited by way of RTGS/NEFT to the account details mentioned herein below: BANK NAME: AXIS BANK LIMITED BRANCH: BANDRA KURLA COMPLEX, MUMBAI BANK ACCOUNT NO. Current Account No. 911020045677633 IFSC CODE: UTIB0000230.

3) The mortgagors/borrowers are given a last chance to pay the total dues with further interest before auction, failing which secured assets will be sold as per above schedule.

4) The mortgagors/borrowers are requested to collect your all remaining movable items within period of 7 days without damages of the property. If you fail to take movable assets, then it would be deemed that you have no claim and no interest in taking back such items. In case you still prefer to ignore this notice, we shall be constrained to treat them as unclaimed and waste materials and shall not be liable for any loss or damage whatsoever to such articles and also may sell all movable items and adjust the amount against outstanding dues of your loan account. It will be also deemed that you have no claim and interest in taking back such items and also have no objection, if such items are disposed-off or sold by us as items are having negligible substantial value. Also note

ઈફકો અધ્યક્ષ શ્રી દિલીપ સંઘાણી એ જોઈનના પ્રધાનમંત્રી શ્રી જાફર હસન સાથે મુલાકાત કરી



અમદાવાદ, ભારત—જોઈન વચ્ચે ખાતર ક્ષેત્રને વધુ મજબૂત દ્વિપક્ષીય સંબંધોની પ્રશંસા કરતા જણાવ્યું કે કૃષિ મજબૂત બનાવવા માટેની મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ઈફકો ક્ષેત્રમાં સહકાર બંને દેશોની અર્થવ્યવસ્થાને નવી દિશા (IFFCO) ના અધ્યક્ષ શ્રી દિલીપ સંઘાણી એ જોઈનના આપશે? શ્રી દિલીપ સંઘાણીએ જોઈન સરકારના સહયોગ પ્રધાનમંત્રી શ્રી જાફર હસન સાથે અમાન ખાતે પ્રધાનમંત્રી અને સમર્થન માટે આભાર વ્યક્ત કરતાં કહ્યું કે ઈફકો અને નિવાસ ખાતે મુલાકાત કરી હતી. આ સીલાર્ટપૂર્ણ મુલાકાત જિફકો (JIFCO) ના સંયુક્ત પ્રયાસોથી આગામી સમયમાં દરમિયાન બંને પક્ષો વચ્ચે ખાતર ઉદ્યોગના વિકાસ, નવીન ખાતર ઉત્પાદન ક્ષેત્રે નોંધપાત્ર વૃદ્ધિ થશે, જેનો સીધો લાભ ટેકનોલોજીનો ઉપયોગ, કૃષિ ઉત્પાદકતા વધારવા અને બંને દેશોના ખેડૂતોને મળશે? આ પ્રસંગે જિફકો (JIFCO) ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવા જેવા મુદ્દાઓ પર ના અધ્યક્ષ પ્રો. મહમ્મદ કે. થનેબત, ઈફકો મેનેજિંગ ડિરેક્ટર ચર્ચા થઈ હતી.

પ્રધાનમંત્રી શ્રી જાફર હસને ભારત-જોઈન વચ્ચેના કપૂર તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

SAR AUTO PRODUCTS LIMITED							
Regd. Office : 50-E BHAKTINAGAR INDS ESTATE,RAJKOT 360 001							
CIN: L34100GJ1987PLC010088							
Website: www.sarautoproductsLtd.com, Email: sapl@sarautoproductsLtd.com							
Extract of Unaudited Financial Result for the quarter ended on 30th September, 2025							
(Rs.In Lacs except per share data)							
Sr. No.	Particulars	Quarter Ended			Half Year Ended		
		30-Sep-25 (Unaudited)	30-Jun-25 (Unaudited)	30-Sep-24 (Unaudited)	30-Sep-25 (Unaudited)	30-Sep-24 (Unaudited)	31-Mar-25 (Audited)
1	Total Income from Operations (net)	241.37	226.94	434.66	468.31	814.36	1,396.79
2	Net Profit/Loss for the period before Tax, Exceptional and Extra Ordinary Items	13.98	11.55	31.53	25.54	61.24	72.89
3	Net Profit/Loss for the period before Tax after Exceptional and Extra Ordinary Items	13.98	11.55	31.53	25.54	61.24	72.89
4	Net Profit/Loss for the period after tax (after Extraordinary Items)	13.98	11.55	31.53	25.54	61.24	41.77
5	Total Comprehensive Income for the period	14.47	12.16	31.60	26.63	61.58	42.33
6	Paid up Equity Share Capital (Face Value of Share Rs. 10 each)	476.47	476.47	476.47	476.47	476.47	476.47
7	Reserves Excluding Revaluation Reserves	-	-	-	-	-	1,254.45
8	Earnings per Share (EPS) : (for continuing operations)						
(a) Basic (Not Annualised)		0.29	0.24	0.66	0.54	1.29	0.88
(b) Diluted (Not Annualised)		0.29	0.24	0.66	0.54	1.29	0.88

Note :-

a) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the websites of the Stock Exchange(s) and the listed entity.

b) The impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies shall be disclosed by means of a footnote.

c) # - Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules / AS Rules, whichever is applicable.



For and on behalf of Board of Director,
Ramesh D. Virani
Managing Director
DIN : 00313236

NOTICE

LARSEN & TOUBRO LIMITED

Regd.Office of the Company: L & T House, Ballard Estate, Narottam Morarjee Marg, Mumbai, Maharashtra, 400001

Notice is hereby given that the certificate(s) for the mentioned securities of the Company have been lost/misplaced and the holder(s) of the said securities have applied to the Company.

Any person who has claim in respect of the said securities should lodge such claim with the company at its Registered Office with in 15 days from this date, else the company will proceed to issue duplicate share certificate(s) without further intimation.

Name of the Holder	Folio No.	Kind of securities & Face value	No. Of Securities	Distinctive Nos.	Certificate Nos.
SHETH SHANTILAL KESHAVALAL	70395134	Equity Shares Face Value of Rs.2/- each	145	5778262 -5778406	111153
SHETH SHANTILAL KESHAVALAL	70395134	Equity Shares Face Value of Rs.2/- each	145	143764082 -143764226	259187
SHETH SHANTILAL KESHAVALAL	70395134	Equity Shares Face Value of Rs.2/- each	290	579754034 -579754323	374875
SHETH SHANTILAL KESHAVALAL	70395134	Equity Shares Face Value of Rs.2/- each	290	620786676 -620786965	466373

Place: Halol
Date: 13-11-2025

માસ રૂરલ હાઉસિંગ અને મોર્ટેગેજ ફાઇનાન્સ લિમિટેડ	
રજીસ્ટર્ડ ઓફિસ: ડબ્લો માળ, નારાયણ ચેમ્બર્સ, પતંગ હોટેલ પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ - ૩૮૦ ૦૦૮.	
શાખા બંધ કરવાની સૂચના	
ખાસ કરીને દેવાદારો અને સામાન્ય રીતે જાહેર જનતાને આથી સુવિધા કરવામાં આવે છે કે કંપનીની શાખા કચેરી, ટી-૮, રાધા આકેડેમી, ઇન્દિરા સ્ટેચ્યુ પાસે, તાલુકા: આણંદ, જિલ્લા આણંદ, ઉ મહિના પછી બંધ થવા જઈ રહ્યું છે અને નવી શાખાનું સરનામું ૧૦૦૭, ૧૧૦ માળ, નારાયણ એમ્પાયર, પંચાલ હોલ પાસે, આણંદ-૩૮૮૦૦૧ રહેશે.	
જો ઉ મહિના પછી પણ બંધ ન થાય, તો અલગથી જાણ કરવામાં આવશે. વધુ વિગતો માટે કૃપા કરીને ૦૭૯ ૬૮૨૭૪૧૦૦ / manish_dave@mas.co.in પર સંપર્ક કરો.	
માસ રૂરલ હાઉસિંગ અને મોર્ટેગેજ ફાઇનાન્સ લિમિટેડ વતી	
સહી/-	
અધિકૃત અધિકારી	
તારીખ: ૧૪.૧૧. ૨૦૨૫	

SHANTAI INDUSTRIES LIMITED

CIN: L46411GJ1988PLC013255

Reg Office: Shop 10 2nd Floor, Agrasen Point, Nr Agrasen Bhavan, Citylight Road, Bharthana, Surat, Gujarat, 395007

Website: www.shantaiindustrieslimited.com, Email-id: shantaiindustriesLtd@gmail.com, Tel: 0261-2211212

The Standalone Unaudited Financial Results for the quarter and half year ended 30th September, 2025 have been filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone Unaudited Financial Results for the said period is available on the websites of the Stock Exchange(s) at www.bseindia.com and the listed entity at https://shantaiindustrieslimited.com/quarterly-reports/

The Standalone Unaudited Financial Results for the quarter and half year ended 30th September, 2025 have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at their meeting held on 12th November, 2025

ગુજરાત સરકારની ઉદ્યોગસાહસિકતા તાલીમ દ્વારા રાજ્યના આદિજાતિ યુવાનો બની રહ્યા છે આત્મનિર્ભર, છેલ્લા ૪ વર્ષમાં ૧૨૦થી વધુ યુવાનો સફળ ઉદ્યોગસાહસિક બન્યા

ગાંધીનગર એચ.ઓ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ હંમેશા આદિજાતિ સમુદાય આત્મનિર્ભરતાના પથ પર અગ્રેસર બને એ સુનિશ્ચિત કર્યું છે. તેમના આ વિઝનને અનુસરીને ગુજરાત સરકાર રાજ્યના આદિજાતિ સમાજના આર્થિક સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે અવિરત પ્રયાસો કરી રહી છે. ગુજરાતના ઉદ્યોગ કમિશનર કાર્યાલય હેઠળ કાર્યરત સેન્ટર ફોર ઓન્ટ્રાપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ (CED ગુજરાત) આદિજાતિ યુવાનોના કૌશલ્ય, રોજગાર અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે ઘણા વર્ષોથી ઉદ્યોગસાહસિકતા તાલીમ અને કૌશલ્ય વિકાસની સુવિધાઓ પૂરી પાડી રહ્યું છે.

૪ વર્ષમાં ૧૦૦૦થી વધુ યુવાનોને ઉદ્યોગસાહસિકતા તાલીમ, ૨ કરોડનો ખર્ચ, ૧૨૦ બન્યા સફળ ઉદ્યોગસાહસિક

છેલ્લા ચાર વર્ષો (૨૦૨૧-૨૨ થી ૨૦૨૪-૨૫)માં ગુજરાત સરકારના ઉદ્યોગ કમિશનર કાર્યાલય હેઠળ કાર્યરત સેન્ટર ફોર ઓન્ટ્રાપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ (CED) દ્વારા ૧૪થી વધુ આદિજાતિ જિલ્લાઓમાં ઉદ્યોગસાહસિકતા વિકાસ કાર્યક્રમ (EDP) અને જાગૃતિ માટેના વર્કશોપ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેણે હજારો યુવાનોને આત્મનિર્ભર બનવા માટે પ્રેરિત કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારની આ વિશેષ પહેલ દ્વારા દર વર્ષે આદિજાતિ વિસ્તારોના લગભગ ૨૦૦થી વધુ યુવાનોને વિવિધ ઉદ્યોગસાહસિકતા સંબંધિત વ્યાવસાયિક તાલીમ આપવામાં આવે છે, જેના કારણે રાજ્યના આદિવાસી જિલ્લાઓના લગભગ ૩૦થી વધુ તાલીમાર્થીઓ સ્વરોજગાર અને આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહ્યા છે.

છેલ્લા ચાર વર્ષમાં રાજ્ય સરકારે ૨ કરોડ ખર્ચને ૧,૦૦૦થી વધુ આદિજાતિ યુવાનોને ઉદ્યોગસાહસિકતા તાલીમ પૂરી પાડી છે. આમાંથી આત્મનિર્ભર બનેલા ૧૨૦થી વધુ યુવાનો હવે સફળતાપૂર્વક પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા છે.

તે જ રીતે, કૌશલ્ય વિકાસના પ્રયાસના ભાગરૂપે ૨૦૨૧-૨૨થી ૨૦૨૪-૨૫ દરમિયાન ૧,૩૦૦થી વધુ આદિજાતિ યુવાનોને કૌશલ્ય વિકાસની તાલીમ આપવામાં આવી હતી. નોંધનીય બાબત એ છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં ૨૨૩ આદિજાતિ યુવાનોને તાલીમ પછી પ્રત્યક્ષ રોજગારની હદો મળી છે.

ગુજરાત સરકારના પ્રયાસો સફળ થયા, આદિજાતિ યુવાનોએ દર્શાવ્યું ઉદ્યોગસાહસિકતાનું શક્તિશાળી મોડલ- ગુજરાતમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા તાલીમના કારણે પાયાના સ્તરે પરિવર્તન જોવા મળ્યું છે. વલસાડ જિલ્લાના ગુંડલવ GIDCમાં રહેતા શ્રી હિતેશ પટેલે પણ રાજ્ય સરકારના ઝંઝૂક થી બિઝનેસ ડેવલપમેન્ટ સંબંધિત તાલીમ મેળવ્યા બાદ સ્ટાર્ટઅપ ઈકિવપમેન્ટ સંસ્થાની સ્થાપના કરી. રાસાયણિક ઉદ્યોગમાં વપરાતા પ્રોસેસ પંપના નિર્માણમાં તેમની કંપની હવે અગ્રેસર બની ગઈ છે.

આદિત્ય બિરલા ગ્રુપ અને MERCK જેવા દિગ્ગજ ગ્રાહકો, ૧૫ સભ્યોની ટીમ અને ૩ કરોડનું વાર્ષિક ટર્નઓવર એ દર્શાવે છે કે પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ માટે કૌશલ્ય આધારિત ઉદ્યોગસાહસિકતા કેટલી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

ડાંગના આદિજાતિ વસ્તીના શ્રીમતી દશાબેન બિરાડીએ ઝંઝૂકની તાલીમ અને સખી મંડળના સહયોગથી અંબિકા હળદર ફાર્મની સ્થાપના કરીને પરંપરાગત હળદરની ખેતીને આધુનિક એગ્રો-બિઝનેસમાં પરિવર્તિત કરી છે. તેમનું વાર્ષિક ટર્નઓવર હવે ૮૦ લાખથી વધુ છે, અને સાથે સ્થાનિક મહિલાઓને રોજગારી પણ આપે છે.

અન્ય એક ઉદાહરણ વડોદરા જિલ્લાના વાધોડિયાના રહેવાસી શ્રી તરુણ વસાવાનું છે, જેમણે JSP પ્લાસ્ટિક્સના માધ્યમથી પ્લાસ્ટિક ઉત્પાદન ક્ષેત્રમાં મજબૂત ઓળખ સ્થાપિત કરી છે. ૧૫ લોકોને રોજગાર આપતા તેમના યુનિટનું વર્તમાન વાર્ષિક ટર્નઓવર લગભગ ૧ કરોડનું છે, અને હવે તેઓ સૌર ઊર્જા ઈન્સ્ટોલેશનના નવા વ્યવસાય સાથે પોતાના સાહસને વિસ્તૃત કરી રહ્યા છે. તો અરવલ્લી જિલ્લાના મેઘરજના શ્રીમતી જયાબેન વરસતે ગુજરાત સરકારના CEDમાંથી તાલીમ લીધા બાદ જયશ્રી ઓર્ગેનિક ગુલુ ઉદ્યોગની સ્થાપના કરી છે. આજે તેઓ ૨૫ લોકોને રોજગારી આપીને ગ્રામીણ મહિલા ઉદ્યોગસાહસિકતાનું શક્તિશાળી મોડલ રજૂ કરી રહ્યા છે.

આદિજાતિ સમુદાયના આર્થિક સશક્તિકરણ માટે ગુજરાતનું ઉદ્યોગસાહસિકતા તાલીમ મોડલ શું છે? ગુજરાત સરકારના ઉદ્યોગસાહસિકતા તાલીમ મોડલમાં ૪૨ સ્કિલ અપ-ગ્રેડેશન સેન્ટર્સ, એન્ટર ઈન્સ્ટિટ્યૂટ્સ, ઉદ્યોગ-આધારિત બ્રિજ અભ્યાસક્રમો અને સ્પેશ્યલાઈઝડ કૌશલ્ય વિકાસ કેન્દ્રોનો સમાવેશ થાય છે. આધુનિક સાધનો, સ્માર્ટ વર્ગખંડો અને સ્થાનિક ઉદ્યોગો સાથેની ભાગીદારી દ્વારા આ કેન્દ્રોને એટલા સક્ષમ બનાવવામાં આવ્યા છે કે તાલીમ ઉદ્યોગસાહસિકતા અને રોજગારીમાં પરિવર્તિત થઈ શકે.

અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે ટુ-વ્હીલર ચાલકનું કમકમાટીભર્યું મોત, એકને ઈજા

અમદાવાદ, અમદાવાદ શહેરના માર્ગો પર બેફામ ડ્રાઇવિંગનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઓઢવ રિંગ રોડ બ્રિજ નીચે રવિવારે મોડી રાત્રે એક અજાણ્યા પૂરપાટ ઝડપે આવતા વાહને ટુ-વ્હીલરને ટક્કર મારતા ૪૫ વર્ષીય ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઓઢવ ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર આ દુઃખદ ઘટના રવિવારે રાત્રે આશરે ૧૧:૪૫ વાગ્યે બની હતી. મૃતકની ઓળખ ગોવિંદ પરમાર (ઉંમર ૪૫) તરીકે થઈ છે, જેઓ શૈલેષ પરમાર સાથે ટુ-વ્હીલર પર સવાર હતા. જ્યારે તેઓ ઓઢવ રિંગ રોડ ઈન્ટરસેક્શન બ્રિજ નીચેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક અજાણ્યા વાહને પાછળથી તેમના ટુ-વ્હીલરને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને સવાર ટુ-વ્હીલર પરથી ફંગોળાઈ ગયા હતા.

ગોવિંદ પરમારને ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. જ્યારે શૈલેષ પરમારને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત સર્જનાર વાહન ચાલક અંધારાનો લાભ ઉઠાવી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. આ મામલે મૃતકના સંબંધી અને ઓઢવાના રહેવાસી મહેશભાઈ પરમાર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને મોટર વ્હીકલ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એક વરિષ્ઠ ટ્રાફિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 'અમે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ હિટ એન્ડ રન કેસમાં વાહનની ઓળખ કરવા માટે આસપાસના વિસ્તારના તેમજ નજીકના ટોલ પોઈન્ટના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા
Central Bank of India

૧૪ નવેમ્બર, ૨૦૨૫ નાં રોજ આયોજિત

મેગા કૃષિ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ

માં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, મરઘા ઉછેર થી સૌર ઊર્જા સુધી, દરેક કૃષિ સપનાં ને અનુકૂળ વિત્તીય સેવાઓ પુરી પાડે છે.

સેન્ટ પોલ્ટ્રી યોજના

- મરઘાં પાલન વ્યવસાયની સ્થાપના અને વિસ્તરણ
- વ્યાજ દર ૮.૩૫% થી શરૂ
- ₹૫૦ કરોડ સુધી લોન

સેન્ટ ફુડ પ્રોસેસીંગ પ્લસ યોજના

- ચોખા, તેલ, દાળ, દુધ અને અન્ય પ્રોસેસીંગ યુનિટ માટે યોજના
- વ્યાજ દર ૭.૮૫% થી શરૂ
- ₹૧૦૦ કરોડ સુધી લોન

સેન્ટ કોલ્ડ સ્ટોરેજ યોજના

- કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસ સ્થાપના માટે ફાઈનાન્સ
- વ્યાજ દર ૭.૮૫% થી શરૂ
- ₹૫૦ કરોડ સુધી લોન

સેન્ટ SHG - NRLM યોજના

- રિવોલ્વીંગ કેશ ક્રેડિટ અને ટર્મ લોન સપોર્ટ
- વ્યાજ દર ૮.૭૦% થી શરૂ
- ₹૨૦ લાખ સુધી લોન

સેન્ટ સોલાર - પીએમ કુસુમ યોજના

- ૨ મેગા વોટ સુધી સોલાર પ્લાન્ટ્સ માટે ફાઈનાન્સ
- વ્યાજ દર ૮.૭૦% થી શરૂ
- ₹૧૦ કરોડ સુધી લોન

તમારી દરેક કૃષિ જરૂરીયાત માટે પ્રાપ્ત કરો - આસાન અને સુલભ લોન. વધુ માહિતી માટે આપની નજીકની શાખા, ક્ષેત્રીય કાર્યાલય અથવા અંચલ કાર્યાલયનો સંપર્ક કરો.

Give us a Missed Call for Loan Assistance

Toll Free Number **1800 30 30**

WhatsApp Number **7900 123 123**

*નિયમો અને શરતો લાગુ.

www.centralbank.in

MEHTA SECURITIES LIMITED					
CIN: L67120GJ1994PLC022740					
Reg. Off: 2, Law Garden Apartment, Scheme-1, Opp. Law Garden, Ellisbridge, Ahmedabad - 380006					
E-mail: mehtasec@gmail.com Website: www.mehtasecurities.com					
Ph: +91 9377578519					
Extract of Statement of Standalone Unaudited Financial Results for the Quarter and Half year ended 30/09/ 2025					
(Rs. In Lakhs except EPS)					
Sr. No.	Particulars	Quarter ended 30/09/ 2025 (Unaudited)	Quarter ended 30/09/2024 (Unaudited)	Half Year ended 30/09/2025 (Unaudited)	Year ended 31/03/2025 (Audited)
1	Total Income from operation(Net)	13.20	14.04	18.64	45.41
2	Net profit / (loss) for the period (before tax, exceptional and /or extraordinary items)	5.82	7.81	-0.74	15.84
3	Net profit / (loss) for the period before tax (after exceptional and /or extraordinary items)	5.82	7.81	-0.74	15.84
4	Net profit / (loss) for the period after tax(after exceptional and /or extraordinary items)	5.82	7.81	-0.74	15.84
5	Total Comprehensive Income for the period comprising Profit(Loss) and Other Comprehensive Income for the period (after tax)	5.82	7.81	-0.74	15.84
6	Paid up Equity Share Capital(Rs.10/- each)	308.94	308.94	308.94	308.94
7	Other Equity				245.18
8	Earning per share (Rs. 10/-each) Basic and Diluted	0.19	0.25	-0.024	0.51

Note:

(1)The above is an extract of the detailed format of Unaudited Financial Results for the Quarter and Half Year ended 30/09/2025 field with Stock Exchange under Regulation 33 of the SEBI(Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015.

(2)The full format of the same alongwith the notes is available on the website of Stock Exchange at www.bseindia.com and at the website of the Company at www.mehtasecurities.com



For, Mehta Securities Limited
SD/-
Bhavna D. Mehta
Chairperson & Managing Director
(DIN: 01590958)

CRESTCHEM LIMITED									
CIN: L24100GJ1991PLCO15530									
Regd Office Address: Sr. No.550/1, Sub Plot No. 12,									
Village- Indrad, Taluka- Kadi, Mahesana- 382715									
Corporate Office:303B, Central Business Space, Opp: Fortune Land Mark Hotel, Opp: HDFC Bank, Near Usampanpara Cross Road, Ashram Road, Ahmedabad-38001									
UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30TH SEPT, 2025									
(Rs in Lacs)									
Sr. No.	Particulars	STANDALONE FINANCIALS			Half Year Ended	Year ended	Year ended		
		Quarter ended						31.03.2025	31.03.2024
		30.09.2025	30.06.2025	30.09.2024					
		Un-audited	Un-audited	Un-audited	Un-audited	Audited	Audited		
1	Income								
	Revenue from operations	719.31	503.09	780.31	1,222.39	2,507.72	2,125.62		
	Other Operating income	-	-	-	-	-	-		
	a) Total Income from Operations (net)	719.31	503.09	780.31	1,222.39	2,507.72	2,125.62		
	b) Other Income	14.52	12.81	12.03	27.32	43.87	26.16		
	Total Income (a+b)	733.83	515.89	792.34	1,249.72	2,551.59	2,151.78		
2	Expenses								
	a) Cost of Material Consumed	571.60	395.61	558.68	967.21	1,876.31	1,610.24		
	b) Purchase of Stock-in-Trade	-	-	-	-	-	-		
	c) Changes in Inventories of Finished Goods, Work-in-progress and stock-in-trade	-0.05	0.03	-0.23	-0.02	-0.03	-		
	d) Excise duty on Sales	-	-	-	-	-	-		
	e) Employee benefits expense	30.50	23.80	26.51	54.30	116.28	66.86		
	f) Finance Costs	0.10	0.07	0.47	0.17	1.30	0.62		
	f) Depreciation & amortization expenses	1.72	1.72	1.16	3.44	5.23	4.63		
	g) Other Expenses	55.79	47.64	67.61	103.42	186.82	171.41		
	Total Expenses (a+b+c+d+e+f+g)	659.67	468.87	654.20	1,128.53	2,185.91	1,853.77		
3	Profit before Tax (1-2)	74.16	47.03	138.14	121.18	365.68	298.01		
4	Tax Expenses								
	(i) Current Tax	19.31	12.26	38.55	31.57	93.86	83.87		
	(iii) Deferred Tax	0.39	-0.03	-0.11	0.36	-0.96	-0.90		
	(iii) Short / Excess Provision of Income Tax	-	-	-	-	0.13	0.41		
	Total Tax (i+ii)	19.70	12.23	38.44	31.93	93.03	83.38		
5	Profit for the period (3-4)	54.46	34.80	99.70	89.26	272.65	214.63		
6	Less: Non Controlling Interest	-	-	-	-	-	-		
6	Net Profit after Non Controlling Interest (5-6)	-2.86	-2.86	-2.86	-	-2.86	-2.86		
6	Other Comprehensive Income	-	-	-	-	-	-		
7	Total comprehensive income for the period (5+6) (Comprising Profit/(Loss) and other Comprehensive income for the period)	54.46	34.80	99.70	89.26	272.65	214.63		
8	Paid-up Equity share Capital -Face Value of ` 10 each-	300.00	300.00	300.00	300.00	300.00	300.00		
9	Earning per equity share (EPS) in ` (not Annualised)								
		BASIC	1.82	1.16	1.13	2.98	9.09		
		DILUTED	1.82	1.16	1.13	2.98	9.09		
Notes :									
(I)	The Financial Results have been prepared in accordance with Indian Accounting Standards (Ind AS) as prescribed under section 133 of Companies Act,2013 read with Rule 3, of the Company's (Indian Accountg Standards) Rule 2015 and Relavent Amendments thereunder.								
(II)	The above Unaudited Financial Results for the Quarter ended and half year ended on September 30, 2025 have been reviewed by the Audit Committee and were taken on record by the Board of Directors in their respective meetings held on 12th November, 2025 and a Limited Review of the same has been carried out by the Statutory Auditors of the Company.								
(III)	The Statutory Auditors of the company have carried out a "Limited Review"of the above results as per Regulations 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.								
(IV)	The Company operates only in one segment viz. Nutrition- Chemical Industries.								
(V)	Figures for the previous period have been regrouped, reclassified and restated wherever necessary to make them comparable with the current period's figures.								
					By order of Board of Directors For Crestchem Limited				
					Sd/- Dipak Patel Managing Director (DIN : 02052080)				
Place : Ahmedabad Date: 12th November. 2025									